

ત્વરિત જાહેરાત માટે

## સિટીની સર્વાંગી પરિવર્તનશીલ રિવરવોક પરિયોજના અમલ થવાને આરે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 સપ્ટેમ્બર 2020) – સીટી ઓફ બ્રેમ્પટન પોતાની રિવરવોક પરિયોજના સાકાર કરવાને આરે છે જે એક સર્વાંગી પરિવર્તનક્ષમ પહેલ છે જે ડાઉનટાઉન બ્રેમ્પટનની આર્થિક સંભાવનાઓને છતી કરવામાં મદદરૂપ થશે.

આ મહિનાની શરૂઆતમાં ડાઉનટાઉન બ્રેમ્પટન ફ્લડ પ્રોટેક્શન ઈન્વાયરનમેન્ટલ અસેસમેન્ટને માન્યતા મળી હતી. સિટી હવે ઈટોબિકોક ખાડીને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં પહોળી કરવાની વિગતવાર ઈજનરી ડિઝાઇન અંગે આગળ વધી શકશે જેનો આધાર સરકારી નીધિયન પર છે. ઈજનરી ડિઝાઇન આ વિસ્તારમાં પુર આવવાના પ્રવર્તમાન જોખમને ઘટાડશે અને રિવરવોક કાર્યરત કરવા માટેનો પાયો નાંખશે.

રિવરવોક પરિયોજના બ્રેમ્પટનના ડાઉનટાઉનમાં જીવનશક્તિનો સંચાર કરવામાં મદદરૂપ થશે અને તેને ટકાઉ, સ્વસ્થ અને સ્થિતિસ્થાપક બનાવશે. રિવરવોકનો મુખ્ય હેતુ એટલે એક નવતર, લાંબા ગાળાનો ઉકેલ શોધવો જેથી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં પૂરના જોખમને અલવીદા કરી શકાય, જેને પરિણામે શહેરી વિકાસ થઈ શકે અને જે નિવેશને આકર્ષે અને આ વિસ્તારની જાહેર જગ્યાઓમાં સુધારો લાવી શકાય.

### રિવરવોક વિષયક

ડાઉનટાઉન બ્રેમ્પટન ઈટોબિકોક ક્રીક ફ્લડપ્લેઈનના વિસ્તારમાં આવેલ છે. જોખમ પ્રબંધન અંગેની પ્રોવિન્સની નીતિઓ અન્યાર સુધી તો ત્યાં આજે જે વિકાસની માત્રા કે પ્રકાર સાધી શકાય તેને રૂંધતી આવી છે. પુરના જોખમોનું નિરાકરણ અને નવી ખુલ્લી શહેરી જગ્યાઓનું સર્જન જે બ્રેમ્પટનના ડાઉનટાઉન વિસ્તારને સ્વસ્થ, ટકાઉ અને સ્થિતિસ્થાપક બનાવે તેનો દ્વિમુખી ઉકેલ એટલે રિવરવોક.

ડાઉનટાઉન બ્રેમ્પટનમાં હાલનાં પુરના જોખમો તેમજ આયોજન અને વિકાસ પરના પ્રતિબંધો દૂર કરીને રિવરવોક પરિયોજના ઈટોબિકોક ખાડીને નવરૂપાંતરિત થતી જુએ છે જ્યાં તેની ફરતે જાહેર સ્થળો અને ઉદ્યાનો હોય જે ઈટોબિકોક ક્રીક વેલી કોરિડોર અને ટ્રેઈલ સિસ્ટમથી જોડાયેલ હોય. તેનાથી ડાઉનટાઉનમાં 3.6 મિલિયન ચોરસ ફુટ રહેણાક, વાણિજ્યિક અને છૂટક જગ્યા ઊભી થશે જેનાથી 23,000 રોજગાર સર્જશે અને GDP પર \$1.4 બિલિયન જેટલો પ્રભાવ પડશે.

આવતા કેટલાક મહિનામાં રહેવાસીઓને આ પરિયોજનામાં પોતાના અભિપ્રાયો આપવાની તક સાંપડશે.

રિવરવોક પર વધુ માહિતી માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/riverwalk](http://www.brampton.ca/riverwalk)

### અવતરણો

"ડાઉનટાઉન બ્રેમ્પટનની સંભાવનાઓ ખોલવી તે કાઉન્સિલની એટલી જ અગત્યની અગ્રિમતા છે જેટલી તેને ગ્રીન સિટી બનાવવાની જે મજબૂત હોય, સ્થિતિસ્થાપક અને ટકાઉ હોય. રિવરવોક એક સર્વાંગી પરિવર્તનક્ષમ પરિયોજના છે જે આ બંને લક્ષ્યો પામવામાં મદદરૂપ થશે

અને સાથે જ તે તેના પુરના જોખમને નાથવાના નવતર અને પ્રભાવી ઉકેલથી, વિકાસ સાધવાના અને રોજગાર ઊભો કરવાના અને તમામ લોકો જાહેર સ્થળોના સુધારા અંગેના ઉકેલથી બ્રેમ્પટનને નકશા પર લાવશે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન એક તકોથી ભરેલું શહેર છે જે સર્જનાત્મક, કંઈક નવું કરવાની અને સાહસી આબોલવાને પ્રોત્સાહિત કરે છે જેમાં એવું ડાઉનટાઉન છે જે ગતિશીલ છે અને વિકાસના પંથે છે. સિટી જ્યારે રિવરવોક બનાવવાને આરે છે ત્યારે આપણે વધુ રોજગાર અને જાહેર સ્થળો ઊભા કરવા વધુ એક ડગલું ભરીએ છીએ જેથી રહેવાસીઓ આવનાર ઘણાં વર્ષ સુધી તે માણી શકે."

પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5; પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"રિવરવોક પરિયોજનાથી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં પુરનું જોખમ તો ઘટશે જ પરંતુ સાથે જ તે આપણને તકનું શહેર બનાવવાની અને શહેરી વૃદ્ધિ અને વિકાસ સાધીને આ વિસ્તારમાં નિવેશ આકર્ષીને આપણી અગ્રિમતાને સાકાર કરવામાં મદદરૂપ થશે. આ સર્વાંગી પહેલ સુનિશ્ચિત કરશે કે ડાઉનટાઉન બ્રેમ્પટન ટકાઉ છે, સ્વસ્થ અને સ્થિતિસ્થાપક છે તેમજ અહીં રહેતા અને મુલાકાત લેતા બધાં માટે માણવાલાયક જગ્યા છે."

પેટ ફોર્ટિની, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 7 અને 8 અને પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રેમ્પટનના ઉપપ્રમુખ

"રિવરવોક બ્રેમ્પટન માટે એક રોમાંચક પહેલ છે જેનો ટર્મ ઓવ કાઉન્સિલ પ્રાયોરિટીઝ સાથે સુમેળ છે. ડાઉનટાઉનમાં જીવનશક્તિનો સંચાર કરવામાં મદદરૂપ થવા રિવરવોક પરિયોજનાને આગળ વધારતા રહેવા માટે, આપણા નિવાસીઓ માટે સંપૂર્ણ, ટકાઉ સમુદાયોના સર્જન માટે અને નવીનીકરણ અંગે વૈશ્વિક આગેવાન બનાવવા માટે કર્મચારીગણ પ્રતિબદ્ધ છે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

#### મિડિયા સંપર્ક

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)